



RAN - 2001000104030062

RAN-2001000104030062

S. Y. B. A. (Sem. - IV) Examination October - 2023

Psychology : Paper - IX (Principal) Core Course

Psychology of Adjustment

સૂચના : / Instructions

(૧)

નીચે દર્શાવેલ નિશાનીવાળી વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the details of signs on your answer book

Name of the Examination:

S. Y. B. A. (Sem. - IV)

Name of the Subject :

Psychology : Paper - IX (Principal) Core Course - Psychology of Adjustment

Subject Code No.: 2001000104030062

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

(૨) જમણી બાજુએ દર્શાવેલા અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.

પ્ર. ૧. ટૂંકમાં નિર્દેશ્યા પ્રમાણે ઉત્તર આપો.

૧૦

- (૧) ઉર્જા વ્યવસ્થાના પ્રકારો જણાવો.
- (૨) આકર્ષણ એટલે શું?
- (૩) લગ્ન માટેની જરૂરિયાતના બે કારણો જણાવો.
- (૪) કોઈપણ બે જાતીય સમસ્યાઓ જણાવો.
- (૫) વયવૃદ્ધિની પ્રક્રિયાના પ્રકારો જણાવો.

પ્ર. ૨. તંદુરસ્તીનો અર્થ સમજાવી વ્યાયામની જુદી-જુદી પદ્ધતિઓની ચર્ચા કરો.

૧૩

અથવા

પ્ર. ૨. આત્મીયતા એટલે શું? તેનાં પાસાંઓ ચર્ચો.

૧૩

પ્ર. ૩. કુટુંબનો અર્થ આપી તેના લક્ષણો અને માળખું વિગતે વર્ણવો.

૧૩

અથવા

પ્ર. ૩. શિક્ષણક્રિયાનું મનોવિજ્ઞાન ચર્ચો.

૧૩

- પ્ર. ૪. નીચેનામાંથી કોઈપણ બે વિશે ટૂંકી નોંધ લખો. ૧૪
- (૧) બળાત્કાર
 - (૨) શારીરિક તણાવ
 - (૩) વૃદ્ધવસ્થાની સમસ્યાઓના સ્ત્રોતો
 - (૪) નિયમિત વ્યાયામ માટેના સૂચનો

ENGLISH VERSION

Instructions:

- (1) As per the instruction no. 1 of page no. 1.
- (2) Figures to the right indicate full marks of the question.

- Q. 1. Answer briefly as directed : 10**
- (1) State the types of energy systems.
 - (2) What is attraction?
 - (3) Give two reasons for the need for marriage.
 - (4) Mention any two sexual problems.
 - (5) State the types of aging process.
- Q. 2. Explaining the meaning of fitness; discuss different methods of exercise. 13**
- OR**
- Q. 2. What is Intimacy? Discuss its aspects. 13**
- Q. 3. Define family and describe its characteristics and structure in detail. 13**
- OR**
- Q. 3. Discuss the psychology of teaching action. 13**
- Q. 4. Write short notes on any two of the following : 14**
- (1) Rape
 - (2) Physical stress
 - (3) Sources of aging problems
 - (4) Tips for regular exercise